Admin. Off.: Cello House, Corporate Avenue, 'B' Wing, 1st Floor, Sonawala Road, Goregaon (E), Mumbai - 400 063, (India).

- T.: (022) 2686 3426 / 2686 3427 / 2686 4630
- E : wimplast@celloworld.com
- · W: www.cellowimplast.com, www.cellobubbleguard.com



(An ISO 9001: 2008 Company)

October 31, 2022

To,
Listing Department **BSE Limited**Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001.

Scrip Code: <u>526586</u>

Scrip ID: WIMPLAST

Sub: <u>Submission of Newspaper Advertisement regarding Unaudited Financial Results of</u> the Company for the quarter and half-year ended 30th September, 2022

Dear Sir/ Madam,

In terms of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, enclosed herewith is the copy of Newspaper Advertisement of Unaudited Financial Results for the second quarter and half-year ended 30th September, 2022 published in Newspapers – Business Standard (English) on 29th October, 2022 and Gujarat Mitra (Gujarati) on 30th October, 2022 respectively.

Kindly take the same on your record.

Thanking you.

Yours faithfully,

For Wim Plast Limited

DARSHA
YASH
ADODRA
Date: 2022.10.31
10:53:33+05'30'

Darsha Adodra

Company Secretary & Compliance Officer

(Mem. No.: A32331)

End: A/a



VODAFONE IDEA LIMITED

CIN: L32100GJ1996PLC030976 Registered Office: Suman Tower, Plot No. 18, Sector-11, Gandhinagar - 382 011, Gujarat Email: shs@vodafoneidea.com Website: www.myvi.in Tel: +91-79-66714000 Fax: +91-79-23232251

NOTICE OF THE EXTRAORDINARY GENERAL MEETING AND INFORMATION REGARDING E-VOTING

The Extraordinary General Meeting ('EGM') of Vodafone Idea Limited ("Company") is scheduled on Monday, November 21, 2022 at 5.00 p.m. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") facility to transact the business, as set out in the Notice of EGM ('the Notice').

The EGM is convened in compliance with the applicable provisions of Companies Act, 2013 and rules made thereunder read with General Circulars No. 14/2020 dated April 8, 2020, No. 17/2020 dated April 13, 2020, No. 22/2020 dated June 15, 2020, No. 33/2020 dated Sentember 28, 2020, No. 39/2020 dated December 31, 2020, No. 10/2021 dated June 23 2021, No. 20/2021 dated December 8, 2021 and No. 3/2022 dated May 5, 2022 issued by Ministry of Corporate Affairs ('MCA Circulars') and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. ('Listing Regulations') read with SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 read with Circular No. SEBI/HO/ CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 without the physical presence of the Members at a common venue. The Company has appointed National Securities Depository Limited ('NSDL') to provide VC/OAVM facility along with the remote e-voting facility for the EGM.

In accordance with the above mentioned circulars, the Notice has been sent in electronic mode to members whose email ids are registered with the Company/Depository Participants (DPs). The electronic dispatch of Notice to Members has been completed on Friday, October 28, 2022. The Notice is also available on the Company's website www.myvi.in and also on the websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively.

REMOTE E-VOTING INFORMATION

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules 2014 and Regulation 44 of the Listing Regulations, the Company is pleased to provide e-voting facility to the members for casting their vote electronically on the resolution as set forth in the Notice. Members may cast their votes remotely, using an electronic voting system ("remote e-voting"). The Special Businesses as set out in the Notice, will be transacted through voting by electronic means only. Members attending EGM through VC/OAVM and have not cast their vote on the resolutions forming part of the Notice through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting facility provided during the EGM. Members who have cast their vote through remote e-voting prior to the EGM can attend the EGM but shall not be entitled to cast their vote again. The process for remote e-voting and e-voting at the EGM is provided in the Notice of EGM.

The remote e-voting will start on Thursday, November 17, 2022 at 9:00 A.M. and ends on Sunday, November 20, 2022 at 5:00 P.M. The remote e-voting will be disabled by NSDL thereafter. Once the vote is cast by the Member he/she shall not be allowed to change it subsequently. A member may participate in the EGM after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the EGM

The cut-off date for the purpose of ascertaining the eligibility of members to avail e-voting facility will be Monday, November 14, 2022. The voting rights of members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on the cut-off date. Members are eligible to cast vote only if they are holding shares as on the cut-off date

Members who have acquired shares after the date of sending of the Notice and holding shares on the cut-off date i.e. Monday, November 14, 2022, may obtain Login Id and Password by sending a request at evoting@nsdl.co.in.

In case of any queries/grievances pertaining to remote e-voting / e-voting at the EGM, you may refer to the Frequently Asked Questions for shareholders and e-voting user manual for shareholders available in the 'Downloads' section of www.evoting.nsdl.com or call NSDL on the toll-free number: 1800-1020-990 / 1800-224-430 or send a request at evoting@nsdl.co.in

WEBCAST OF THE EXTRAORDINARY GENERAL MEETING

Members will be able to attend the EGM through VC / OAVM or view the live webcast of EGM at https://www.evoting.nsdl.com by using their remote e-voting login credentials. The detailed procedure for attending the EGM through VC/OAVM is explained in the notes of the Notice of the EGM.

Members are requested to go through the notes set out in the EGM Notice and in particular, instructions for joining the EGM, manner of casting vote through remote e-voting and e-voting during the EGM and attending the EGM through VC/

Consolidated Unaudited Financial Results for the guarter and half year ended September 30, 2022

For Vodafone Idea Limited

Sd/-

Place : Mumbai Dated: October 28, 2022

Pankai Kapdeo **Company Secretary**



VARDHMAN TEXTILES LIMITED

Regd. Office: Chandigarh Road, Ludhiana-141 010. CIN: L17111PB1973PLC003345. PAN: AABCM4692E Website: www.vardhman.com, Email: secretarial.lud@vardhman.com

							(Rs. in Crores)
Sr. No.	Particulars	Quarter Ended Sept 30, 2022 Unaudited	Quarter Ended June 30, 2022 Unaudited	Quarter Ended Sept 30, 2021 Unaudited	Half Year Ended Sept 30, 2022 Unaudited	Half Year Ended Sept 30, 2021 Unaudited	Year Ended March 31, 2022 Audited
1	Total Income from Occuptions	2 400 00	0.004.70	(Refer Note-4)	E 224 77	(Refer Note-4)	0.046.05
2	Total Income from Operations Net Profit/(Loss) for the period	2,499.98 264.69	2,831.79 426.12	2,452.54 628.74	5,331.77 690.81	4,424.50 1,035.49	9,846.85 2,031.19
	(before Tax, Non controlling interest	204.09	420.12	020.74	690.61	1,035.49	2,031.19
	and Share of Profit/(Loss) of						
	Associates and Exceptional items)						
3	Net Profit/(Loss) for the period	264.69	426.12	628.74	690.81	1,035.49	2,031.19
3	before tax, Non controlling interest	264.69	426.12	628.74	690.81	1,035.49	2,031.19
	and Share of Profit/(Loss) of						
	, ,						
4	Associates (after Exceptional items) Net Profit/(Loss) for the period after	204.90	329.12	481.49	534.02	796.19	1,546.89
4	, , ,	204.90	329.12	461.49	534.02	796.19	1,546.89
	tax, Non controlling interest and Share of Profit/(Loss) of Associates						
	, ,						
5	(after Exceptional items) Total Comprehensive Income/	204.90	329.12	481.49	534.02	796.19	1,553.67
	(Expenditure) for the period	204.90	329.12	401.49	334.02	790.19	1,555.67
	[Comprising Profit/(Loss) for the						
	period (after tax) and Other						
	Comprehensive Income/						
	(Expenditure) (after tax)]						
6	Paid-up Equity Share Capital	56.88	56.86	56.66	56.88	56.66	56.84
7	Reserves (excluding Revaluation	8,183.57	7,978.32	7,119.62	8,183.57	7,119.62	7,646.92
l'	Reserve & Non controlling interest)	0,103.37	1,910.32	7,119.02	0,100.07	7,119.02	7,040.92
8	Securities Premium Account	48.18	45.93	26.87	48.18	26.87	44.64
9	Net worth	8,240.45	8,035.19	7,176.28	8,240.45	7,176.28	7,703.76
10	Paid up debt Capital / Outstanding	195.00	394.80	394.80	195.00	394.80	394.80
	debt	193.00	334.00	394.00	193.00	394.00	394.00
11	Outstanding Redeemable	_	_	_	_	_	
''	Preference shares	_	-	_	_	-	-
12	Debt Equity Ratio (times)	0.18	0.21	0.24	0.18	0.24	0.25
13	Earnings Per Share (in Rs.)	0.10	0.21	0.24	0.10	0.24	0.23
'3	(not annualized):						
	(a) Basic	7.20	11.58	16.99	18.78	28.11	54.58
	(b) Diluted	7.20	11.57	16.94	18.77	28.01	54.42
14	Capital Redemption Reserve	40.43	40.43	40.43	40.43	40.43	40.43
15	Debenture Redemption Reserve	57.62	57.62	57.62	57.62	57.62	57.62
16	Debt Service Coverage ratio	3.34	2.60	4.09	3.88	3.48	3.49
17	Interest Service Coverage ratio	13.31	16.86	25.16	15.14	20.62	19.76
NOTE		10.01	10.00	20.10	10.14	20.02	10.70

Place : Ludhiana

Dated: October 28, 2022

1. The above is an extract of the detailed format of quarterly and half yearly financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 The full format of the quarterly and half yearly financial results are available on the Stock Exchanges websites i.e.

www.bseindia.com and www.nseindia.com and also on website of the company www.vardhman.com. For the other line items referred in Regulation 52 (4) of the Listing Regulations, pertinent disclosures have been made to the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited and can be accessed on Company's website i.e www.vardhman.com and on the website of the Stock Exchanges i.e. www.bseindia.com

and www.nseindia.com. 3. The Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards (IND AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder

During the quarter ended March 31, 2022, the equity shares of the parent company had been sub-divided from existing face value of Rs. 10/- per equity shares into 5 equity shares having face value of Rs. 2 per equity shares based on approval by the shareholders through their Postal Ballot dated 11th March, 2022. The Record Date for effecting this sub-division of equity share was March 26, 2022. Accordingly, basic and diluted earnings per equity share for the quarter and half year ended September 30, 2021 have been restated on the basis of number of equity shares after sub-division.

5. Fi		(Rs. in Crores)					
Sr. No.	Particulars	Quarter Ended Sept 30, 2022 Unaudited	Quarter Ended June 30, 2022 Unaudited	Quarter Ended Sept 30, 2021 Unaudited	Half Year Ended Sept 30, 2022 Unaudited	Half Year Ended Sept 30, 2021 Unaudited	Year Ended March 31, 2022 Audited
1	Total income from operations	2,416.85	2,753.31	2,393.71	5,170.16	4,329.31	9,771.36
2	Profit before tax	256.30	415.22	623.48	671.52	1,021.58	2,185.75
3	Net Profit after tax	194.74	313.35	469.80	508.09	770.72	1,677.44
4	Total Comprehensive Income/	194.74	313.35	469.80	508.09	770.72	1,683.96
	(Expenditure)			1	1	1 '	

For Vardhman Textiles Limited





SHRIRAM MUTUAL FUND

Shriram House, No. 4 Burkit Road, T. Nagar, Chennai - 600 017 Shriram Asset Management Company Limited (Investment Manager) Registered Office: 217, 2nd Floor, Swastik Chambers, Near Junction of S.T. & C.S.T. Road, Chembur, Mumbai - 400 071. Tel: 91-33-23373012; Fax: 91-33-23373014; CIN: L65991MH1994PLC079874; Website: www.shriramamc.in

NOTICE

Half-Yearly Unaudited Financial Results of Schemes of Shriram Mutual Fund

NOTICE is hereby given that the unaudited financial results of the Schemes of Shriram Mutual Fund for the half-year ended September 30, 2022 have been hosted on the website of Shriram Asset Management Company Limited (www.shriramamc.in), in accordance with Regulation 59 of SEBI (Mutual Funds) Regulations, 1996. Investors may accordingly view / download the results from the websit

> For Shriram Asset Management Company Limited (Investment Manager of Shriram Mutual Fund)

Date : October 28, 2022 Place: Chennai

Chief Operating Officer

For more information, please contact Shriram Asset Management Co. Ltd., CK-6, 2nd Floor, Sector II Salt Lake City, Kolkata - 700 091. Tel: 033 2337 3012, Fax: 033 2337 3014, Email: info@shriramamc.in Website: www.shriramamc.in

> Mutual fund investments are subject to market risks, read all scheme related documents carefully.



SATIN CREDITCARE NETWORK LIMITED

CIN:L65991DL1990PLC041796

Regd. Office: 5th Floor, Kundan Bhawan, Azadpur Commercial Complex, Azadpur, Delhi-110033 Corporate Office: Plot No. 492, Udyog Vihar, Phase-III, Gurugram, Haryana-122016, India Phone: 0124-4715400, Website: www.satincreditcare.com E-mail: secretarial@satincreditcare.com

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half Year ended September 30, 2022

	(₹ in Lakhs except EPS)						
S. No.	Particulars	Quarter ended September 30, 2022	Quarter ended September 30, 2021	Half Year ended September 30, 2022	Year ended March 31, 2022		
		Unaudited	Unaudited	Unaudited	Audited		
1	Total Income from operations	36,069.54	32,591.20	70,596.89	1,38,089.38		
2	Net (Loss) / Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	7,475.12	1,367.39	(20,523.99)	3,417.86		
3	Net (Loss) / Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	7,475.12	1,367.39	(20,523.99)	3,417.86		
4	Net (Loss) / Profit for the period after tax (after Exceptional and / or Extraordinary items*)	5,719.55	1,094.52	(15,250.04)	2,069.89		
5	Total Comprehensive Income for the period [Comprising (Loss) / Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5,692.95	(1,618.78)	(15,172.00)	(845.42)		
6	Paid up Equity Share Capital	7,869.38	7,149.55	7,869.38	7,459.12		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	1,50,726.22		
8	Securities Premium Account	1,09,378.24	1,04,304.47	1,09,378.24	1,06,455.16		
9	Net Worth	1,31,153.73	1,27,935.21	1,31,153.73	1,49,336.44		
10	Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil	Nil		
11	Debt Equity Ratio	3.84	4.24	3.84	3.67		
12	Paid up Debt Capital/Outstanding Debt	5,53,377.54	5,85,543.49	5,53,377.54	5,74,351.88		
13	Earnings Per Share (₹ 10/- each) (for continuing and discontinued operations) - 1. Basic: 2. Diluted:	7.61 7.12	1.64 1.64	(20.31) (20.31)	2.96 2.72		
14	Capital Redemption Reserve	2,777.00	2,777.00	2,777.00	2,777.00		
15	Debenture Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable		
16	Debt Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable		
17	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable		

*Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit & Loss in accordance with Ind-AS Rules/AS Rules, whichever is applicable. (₹ in Lakhs) Brief of Unaudited Standalone Financial Results for the

Quarter and Half Year ended September 30, 2022						
	Quarter ended	Quarter ended	Half Year ended	Year		
	September	September	September	Ma		

S. No.	Particulars	September 30, 2022 30, 2021		September 30, 2022	Year ended March 31, 2022
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income	32,505.12	29,872.14	98,703.89	1,26,193.49
2	Profit/(Loss) Before Tax	7,141.87	1,560.35	14,110.92	5,936.03
3	Profit/(Loss) After Tax	5,462.04	1,167.56	11,480.20	4,022.51
Nata					

Notes

- The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of Satin Creditcare Network Limited ('the Company') in their meeting held on October 28, 2022
- The above is an extract of the detailed format of Results filed with the Stock Exchange(s) under Regulations 33, 52 & 63 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations. 2015 ('the Listing Regulations'), as amended from time to time. The full format of the Results are available on the website of the Company (i.e. www.satincreditcare.com) and on the websites of the Stock Exchange(s) (i.e. NSE-www.nseindia.com and BSE-www.bseindia.com).
- For the other line items referred in Regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to the Stock Exchange(s) (i.e. NSE-www.nseindia.com and BSE-www.bseindia.com) and can be accessed on the website of the Company (i.e. www.satincreditcare.com).
- These Consolidated Results have been prepared in accordance with Indian Accounting Standards (IND-AS) notified by the Ministry of Corporate Affairs

For Satin Creditcare Network Limited

Place: Gurugram Date: October 28, 2022

(Harvinder Pal Singh) Chairman cum Managing Director DIN: 00333754

Educomp EDUCOMP SOLUTIONS LIMITED

CIN: L74999DL1994PLC061353

Regd. Office: 1211, Padma Tower I-5, Rajendra Place, New Delhi 110008 Tel.: 91-11-2575 5920 Fax: 91-1125766775 E-mail: investor.services@educomp.com, Website: www.educomp.com

NOTICE OF EXTRAORDINARY GENERAL MEETING

lotice is hereby given that the Extraordinary General Meeting (EGM) o the Members of the Company will be held on Tuesday, November 22, 2022 at 11:30 A.M. (through Video Conferencing (VC)/ Other Audio Visual Mode (OAVM) to transact the business specified in the Notice convening the said EGM. Pursuant to the General Circular issued by the Ministry of Corporate Affairs vide circular dated April 08, 2020 and April 13, 2020, May 05, 2020, January 13, 2021, December 14, 2021 and May 05, 2022 (referred as 'MCA Circulars') and Circular SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 12, 2020, January 15, 2021 and May 13, 2022 issued by SEBI (hereinafter collectively referred to as "the Circulars"), companies are allowed to hold AGM/EGM through video conferencing (VC) or other audio-visual means (OAVM), without the physical presence of members at a common venue. In compliance with the said Circulars, the EGM shall be conducted through VC / OAVM. The deemed venue for the EGM shall be the Registered Office of the Company. The instructions for attending the EGM through VC/OAVM are mentioned in the Notice convening the EGM.

The Company has on 27th October, 2022, sent the emails through Link Intime India Pvt. Ltd. containing notice of the EGM to the members whose email IDs are registered with the Depositories or the Company. In view of extraordinary circumstances due to pandemic caused by Covid-19, and in line with the MCA Circulars, physical copies of the EGM Notice are not being dispatched and the EGM Notice has been sent only through email

Members, who have not received the Notice may download it from the vebsite of the Company at www.educomp.com under the 'investors' section or may request for a softcopy of the same by writing to the Company Secretary at the above mentioned email id or registered office address of the Company. The aforesaid Notice of the EGM is also available on the websites of National Stock Exchange at https://www.nseindia.com and Bombay Stock Exchange at nttps://www.bseindia.com_where_the_securities_of_the_Company_are

Shareholders whose email IDs are not registered, are requested to contact the Company at investor.services@educomp.com or NSDL/CDSL (in case of dematerialized shares) or Link Intime India Pvt Ltd. ('RTA') at birendra.singh@linkintime.co.in (in case of physical shares) and send a scanned copy of the request letter signed by all the shareholders along with self-attested copies of PAN Card and address proof to register their email ids.

The instruction for attending the meeting through VC/OVAM and the nanner of participation in the remote e-voting or casting vote at the EGM through e-voting is provided in the Notice convening the EGM. The Notice also contains the instructions with regard to login credentials for shareholders, holding shares in physical form or in electronic form, who have not registered their email address either with the Company or their respective DP. Members participating through VC/OVAM facility shall be counted for the purpose of quorum u/s 103 of the Companies Act. 2013.

The members holding shares in physical form are requested to consider converting their physical shares into dematerialized and eliminate all risks associated with the physical shares. Further, pursuant to the provisions of Section 108 of the Companies Act

2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, and Secretarial Standards on General meetings ('SS-2') the Company is providing to the Members the facility to exercise their right to vote on the business as set forth in the EGM from a place other than the place of venue of EGM by electronic means. The Company has engaged services of Link Intime India Private Limited to provide remote e-voting

The remote e-voting period commences on Friday, November 18, 2022 at 09:00 AM (IST) and shall end on Monday, November 21, 2022 at 05:00 PM (IST). Members of the Company holding shares in physical or dematerialized form as on the cut-off date, being Monday November 14, 2022 may cast their vote by remote e-voting or may vote at the EGM. The voting rights of the members shall be in proportion to their shares in the paid-up share capital of the Company as on cut-off date. A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date shall be entitled to avail the facility of voting through remote e-voting or at the EGM. A person who is not a member on the cut-off date shall treat this Notice for information purposes only. The procedure of e-voting/attending EGM is given in the Notice of EGM.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. Monday, November 14, 2022, may obtain the login ID and password by sending a request at birendra.singh@linkintime.co.ir or investor.services@educomp.com.

Further, the facility of e-voting will also be made available at the EGM and members attending the EGM, who have not cast their votes by remote e-voting shall be able to exercise their right at the EGM Members who have already cast their votes through remote e-voting wil be entitled to attend the EGM but shall not be entitled to vote again.

Mr. P. C. Jain, Company Secretary (Membership No. FCS 4103) from M/s P.C. Jain & Co., Company Secretaries has been appointed as the Scrutinizer to scrutinize the voting and remote e-voting process in a fair and transparent manner.

The Securities and Exchange Board of India (SEBI) vide its notification securities including transmission and transposition requests shall be processed only in dematerialized form. In view of the same and to eliminate all risks associated with physical shares and avail various benefits of dematerialization. Members are advised to dematerialize the shares held by them in physical form. Members may contact the Company in this regard.

In case of any queries, members may contact to RTA at email: birendra.singh@linkintime.co.in or on: - Tel: 022 -4918 6000 or to Resolution Professional, at email <u>mkipeducomp@bdo.in</u> or investor.services@educomp.com.

For Educomp Solutions Limited

Date : October 28, 2022 Place: New Delhi

Sd/-Mahender Khandelwal Resolution Professional

Taken on record
IBBI Reg. No IBBI/IPA-001/IP-P00033/2016-17/10086



Regd. Office: Survey-No.324 / 4 to 7 of Kachigam, Village Kachigam, Daman-396 210. Tel.: (022) 2686 3426/ 3427 | Email: wimplast@celloworld.com CIN: L25209DD1988PLC001544 | Website: www.cellowimplast.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2022

(₹ In lakhs except EPS)

		STANDALONE			CONSOLIDATED							
Post de la constitución de la co			UARTER ENDE	D	HALF YE	AR ENDED	YEAR ENDED					
Particulars	30.09.2022 Unaudited	30.06.2022 Unaudited	30.09.2021 Unaudited	30.09.2022 Unaudited	30.09.2021 Unaudited	31.03.2022 Audited	30.09.2022 Unaudited	30.06.2022 Unaudited	30.09.2021 Unaudited	30.09.2022 Unaudited	30.09.2021 Unaudited	31.03.2022 Audited
Total Income from Operations (Net)	7,886.43	8,038.93	8,671.60	15,925.36	13,974.48	31,675.41	7,950.94	8,093.59	8,783.03	16,044.52	13,779.82	31,875.14
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	1,276.02	1,210.38	1,354.75	2,486.39	1,758.24	4,759.32	1,310.58	1,219.95	1,336.73	2,530.53	1,701.74	4,676.61
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,276.02	1,210.38	1,354.75	2,486.39	1,758.24	4,759.32	1,310.58	1,219.95	1,336.73	2,530.53	1,701.74	4,676.61
Net profit / (Loss) for the period after tax (after Exceptional and/orExtraordinary items)	959.99	907.96	1,019.81	1,867.94	1,321.19	3,533.92	985.80	915.04	1,006.25	1,900.84	1,278.83	3,472.49
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1,029.22	913.25	1,036.53	1,942.47	1,345.40	3,562.68	1,044.72	917.52	1,027.61	1,962.24	1,319.23	3,525.03
Equity Share Capital	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34
Other Equity						40,074.92						39,982.36
Earning Per Share (of Rs. 10/- each) for continuing and discontinued operations)												
1. Basic :	8.00	7.56	8.50	15.56	11.01	29.44	8.13	7.60	8.42	15.73	10.79	29.13
2. Diluted :	8.00	7.56	8.50	15.56	11.01	29.44	8.13	7.60	8.42	15.73	10.79	29.13
	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net profit / (Loss) for the period after tax (after Exceptional and/orExtraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Other Equity Earning Per Share (of Rs. 10/- each) for continuing and discontinued operations)	Total Income from Operations (Net) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) Net profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Other Equity Earning Per Share (of Rs. 10/- each) for continuing and discontinued operations) 1. Basic : 8.00	Total Income from Operations (Net) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net profit / (Loss) for the period after tax (after Exceptional and/orExtraordinary items) Net profit / (Loss) for the period after tax (after Exceptional and/orExtraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Other Equity Earning Per Share (of Rs. 10/- each) for continuing and discontinued operations) 1. Basic: 8.00 7.56	Total Income from Operations (Net) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) Net profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital Other Equity Earning Per Share (of Rs. 10/- each) for continuing and discontinued operations) 1. Basic : 8.00 7.56 8.50	30.09.2022 30.	30.09.2022 30.09.2022 30.09.2022 30.09.2021 30.09.2022 30.09.2021 30.09.2022 30.09.2021 30.09.2022 30.09.2021 30.09.2022 30.	Net Profit / (Loss) for the period (before tax (after Exceptional and/or Extraordinary items) 1,276.02 (after tax) and other Comprehensive Income (after Share Capital) 1,200.34 (after Equity) 1,200.34 (after Exceptional and/or Extraordinary items) 1,20	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 1,276.02 1,210.38 1,354.75 2,486.39 1,758.24 4,759.32 1,310.58 1,	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 1,276.02 1,210.38 1,354.75 1,395.75 1,397.45 1,321.19 3,533.29 3,104.75 3,	Total Income from Operations (Net) 7,886.43 8,038.93 8,671.60 15,925.36 13,974.48 31,675.41 7,950.94 8,093.59 8,783.03 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) 1,276.02 1,210.38 1,354.75 2,486.39 1,758.24 4,759.32 1,310.58 1,219.95 1,336.73 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 1,276.02 1,210.38 1,210.38 1,354.75 2,486.39 1,758.24 4,759.32 1,310.58 1,219.95 1,336.73 Net profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) 1,276.02 1,210.38 1	Registration Regi	Note Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 1,276.02 1,210.38 1,334.75 1,304.55 1,304.75 1

- The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and half year ended September 30, 2022, filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Financial Results for the quarter ended September 30, 2022 is available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website www.cellowimplast.com
- 2. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings neld on October 27, 2022. The statutory auditor of the company have carried out a Limited Review of the aforesaid results

Date: October 27, 2022

For and on behalf of the Board of Directors Wim Plast Limited

Sd/-

Pradeep G. Rathod (CEO, Chairman & Managing Director) (DIN - 00027527)

📵 પશ્ચિમ રેલવે sr.DEE (TRD) મુજબની વિગતે આમંત્રિત કરે છે.

ાર્ગને લાઇક કરો : 🚰 facebook.com/WesternRly પશ્ચિમ રેલવે – વડોદરા ડિવિઝન

લેવલ ક્રોસિંગને બદલે રોડ અન્ડર બ્રિજનું બાંધકામ ઇ-કેન્ડર નોટીસ નં. DRM-BRC 078 OF 2022-23

ારતના રાષ્ટ્રપતિ માટે અને વતી ડિવિઝનલ રેલવે મેનેજ V AVC.) પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરા-390 04 દ્વારા નીચે જણાવેલ કાર્યો માટે સીલબંધ ટેન્ડર મંત્રિત કરે છે. **અનું. નં.1:** ટેન્કર **નં. DRM BR**0 078 of 2022-23. કામનું નામઃ વડોદરા ડિવિઝ-નગર પાલિકા ગોપરા, ગુજરાત માટે ડિપોઝીટ શરતો પ વડોદરા-ગોપરા-સ્તલામ સેક્શન પર ગોપરા રેલ ાવ્યા પ્રદેશ ગીલા, ગુજરા પહે પિકોર અને પ્રદેશ કેવાં હોંદા-ગીલા-ગલા એકામ પ કરોલા કેવાં હોંદા-ગિલા-ગલા એકામ પ કરોલા કેવાં હોંદા-ગિલા-ગલા એકામ પાત્ર કેવાં હોંદા-ગલા હોંદા-ગલા એકામ પાત્ર કેવાં હોંદા પાત્ર હોંદા કેવાં હોંદા માટે અને બારે છે. કેવાં હોંદા માટે અને બારે છે. કેવાં હોંદા માટે એ ખાતે છે. એકામ કેવાં હોંદા માટે એ ખાતે છે. એકામ હોંદા માટે અને બારે છે. એકામ હોંદા માટે અને બારે છે. કેવાં હોંદા માટે અને બારે હોંદા માટે અને અને અપલ હાંદા હોંદા માટે અને અને અપલ હાંદા હોંદા માટે અને બારે હાંદા હોંદા હોંદા

अभानित के छे. छ-दे-उइर नोहीश सं EL-TRU-W-118-21-22-1-54 तारीण:22-1-2022 энньгичү लाम : मुंजर्ड डिजिजला डिब्ता-गरुआंच वखे हुव 15 दिवर पर ठीक्स ठवादर्वर पूरे पाडी पाएप दिवरला टिब्लुशबल्लुं ठाम्स मोडीविश्यल कु काशमः अवेट उधायेव क्रिअत : इ. 43,03,973/- अर्जरक्रमती क्रिअत : इ. 43,03,973/- अर्जरक्रमती हार्का एक प्रतिकाति के स्वाधित क्रिया क्रांत्र अस्म : 30-11-2022 15-00 व्लाक क्रांत्र अस्म : 30-11-2022 15-10 व्लाक क्रांत्र अस्म : 30-1 પ્રકારના કાર્યો,ઢન્ડરન વિગતો મેળવવા plea ireps.gov.in.(મેન્યુલ સ્વીકારવામાં આવશે નહી.)

📵 પશ્ચિમ રેલવે

કારોતે લાઉક કરો : f facebook.com/WesternRly

ase click:www.

0546

🔞 પશ્ચિમ રેલવે

કરે છે. ઇ-ટેન્ડર

આફર સ્વીકારવામાં આવશે નહી.) લાઇક કરો: 🕶 facebook.com/West अभागे HIBS Sरो: f facebook.com/WesternRly પશ્ચિમ રેલ્વે

> દેનોમાં પાર્સલ એસએલઆરભાડે આપવા માટેના કરારની ઇ-હરાજા ગા પાસલએસએલઆર ભાડે આપવા માટે કરે છે. જેની સૂચિ IREPSની વેબ સાઇટ

હરાજી સૂચિ ક્રમાંક MMCT-PLS-22-58

	GIS of
12239-SLR-R1-MMCT-HSR-22-1	19425-SLR-R1-MMCT-NDB-22-1
19425-SLR-F1-MMCT-NDB-22-1	19426-SLR-R1-NDB-MMCT-22-1
19426-SLR-F1-NDB-MMCT-22-1	19425-SLR-F2-MMCT-NDB-22-1
19417-SLR-R1-MMCT-ADI-22-1	19426-SLR-F2-NDB-MMCT-22-1
19417-SLR-F2-MMCT-ADI-22-1	12239-SLR-F1-MMCT-HSR-22-1
19417-SI R-F1-MMCT-ADI-22-1	

હરાજી સૂચિ ક્રમાંક MMCT-PLS-22-59

19001-SLR-F1-VR-ST-22-1	22933-SLR-F1-BDTS-JP-22-1
22828-SLR-F1-ST-PURI-22-2	12995-SLR-R1-BDTS-All-22-1
19001-SLR-F2-VR-ST-22-1	22828-SLR-R1-ST-PURI-22-1
19002-SLR-F2-ST-VR-22-1	12921-SLR-R1-MMCT-ST-22-1
19002-SLR-R1-ST-VR-22-1	19001-SLR-R1-VR-ST-22-1
19002-SLR-F1-ST-VR-22-1	

હરાજી સચિ ક્રમાંક MMCT-PLS-22-60

22909-SLR-R1-BL-PURI-22-1	19015-SLR-F2-MMCT-PBR-22-1
12922-SLR-F1-ST-MMCT-22-1	19015-SLR-R1-MMCT-PBR-22-1
19055-SLR-R1-BL-JU-22-1	22909-SLR-F1-BL-PURI-22-1
12922-SLR-F2-ST-MMCT-22-1	19055-SLR-F1-BL-JU-22-1
20925-SLR-F1-ST-AMI-22-1	20925-SLR-F2-ST-AMI-22-1
20925-SLR-R1-ST-AMI-22-1	

22951-SLR-R1-BDTS-GIMB-22-2

12267-SLR-F1-MMCT-HAPA-22-1	22975-SLR-R1-BDTS-RMR-22-1
22975-SLR-F1-BDTS-RMR-22-1	19037-SLR-R1-BDTS-BJU-22-1
12989-SLR-R1-DDR-All-22-1	19027-SLR-R1-BDTS-JAT-22-1
22451-SLR-R1-BDTS-CDG-22-1	22951-SLR-F1-BDTS-GIMB-22-1
22901-SLR-R1-BDTS-UDZ-22-1	20907-SLR-R1-DDR-BHUJ-22-1
22965-SLR-R1-BDTS-BGKT-22-1	
શરૂઆતનો કુલિંગ પિરિયડ 30 મિનિ	
હરાજી સૂચિ	SHIS MMCT-PLS-22-62
	લોંટ નં
19053-SLR-F2-ST-MFP-22-3	13426-SLR-F2-ST-MLDT-22-1
12943-SLR-R1-BL-CNB-22-1	12227-SLR-F1-MMCT-INDB-22-1

12943-SLR-R1-BL-CNB-22-1	12227-SLR-F1-MMCT-INDB-22-1
12227-SLR-R1-MMCT-INDB-22-1	22903-SLR-R1-BDTS-BHUJ-22-1
12935-SLR-F1-BDTS-ST-22-1	19053-SLR-R1-ST-MFP-22-2
12935-SLR-R1-BDTS-ST-22-1	12943-SLR-F1-BL-CNB-22-1
20943-SLR-R1-BDTS-BGKT-22-1	20943-SLR-F1-BDTS-BGKT-22-1
ઇ-હરાજીની તારીખ અને સમય: બદ શરૂઆતનો કુલિંગ પિરિચંડ 30 મિનિટ	ા જ લોટ માટે 11-11-2022 12-00 કલાક
नोंध : संभवित जीडर्सने IREPSनी वेज	-સાઇડ (www. ireps. gov.in.) પર ઇ-૯૨ાજી માં આવે છે. ત્યાં દ્રાપિત સરિયાં લોટલાર વિરાહ

. મેરિચંડ 30 મિનિટ છે. તબ્બકાવાર લોટ ક્લોઝિંગ સમય-ગાળો 10 મિનિટ

ા છે. માને લાઇક કરો : 🚮 facebook.com/WesternRly અમોને ફોલો કરો : 💟 twitter.com/WesternRly Eक्षिण ગુજરાત વીજ કંપની લિમિટેડ CIN U40102GJ2003SGC042909

ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ, સુરત

જાहेर निविद्या नं. २७ सने २०२२-२३ જાહિર Init(El of, 20 રોબ 2022-23) પુત્રવા સરકારતા શરવાય હતી કાર્યાયલ જ જ કરતી, ઉંકાર્ય લિમા તો, બોએ મળ, તાપી જલ બવન, ઉંકાર્ય તામ કાર્યાયલ હતી હતી, ઉંકાર્યા તામ તો, બોએ મળ, તાપી જલ બવન, ઉંકાર્ય તા.સોનગઢ જિ.તાપી. પીન કોક તો. ૩૯૧૬૦ ફોન તે, ૦૩૬૨૩-૩૩૬૨ લાકા શુલ ૧ (૩) કમા મોટે બેની કાંદ્રાયું તરમ મુશ્કાર, લાખ કી કાર્યાયલ માં એક કાર્યામાં લોધારી શરધાલા માં જ મજદારો પારેકીએ કોને લાભ નિકારતા કોંગ્રવામાં આવે છે. જેવા ટેન્ટરો અખ્યા, ભાગવાના જ મરકારો પારેકી એને લાભ લાદ ઉપર એન લાભ નારતાના કરેતો, માર્ચ ઉંકે એ ભાગ જેવારે અંગ્રે છે. આવત જેવે એ ભાગ જ કરતાં કોંગ્રકી એને લાભ તાતાં હતાં તો, જ કરતાં કોંગ્ર કરતાં હતાં, જ કરતાં કોંગ્ર કરતાં કોંગ્ર કરતાં કોંગ્રે કોંગ્ર કરતાં કોંગ્ર કોંગ્ય કાંગ્ર કોંગ્ર કોંગ્ય કોંગ્ર કોંગ્ર

ભાન લાઇન ખોલવામાં આવશે. ૧. સદ કમા અંગે વધુ વિગતો ઉપયોગ્ત એવ સાર્વદ્રવેબ પર અથવા કાર્યપ કંપબેરશ્રી, ઉંકાઈ વિભાગ ને., બીંગે માળ, તાપી જલ ભવન, ઉંકાઇ તા.સોન જી.તપી.-૩૯૧૬૮૦નો સંપર્ક કરવા જલાવવામાં આવે છે. ૨. નથીલ:-સદર કમાની નિર્વદા અંગે સુધારા/વધારા ઇંક્ત ઉંકત ઓનલાઇન વેબસા પર પ્રસ્થિક કરવામાં આવશે. કમાંક: માહિતી-સૂરત/૧૯૨૩/૨૯૨૨

નોટીફાઇ5 વિભાગ-ગુંદલાવ

जोटीફાઇડ વિભાગ-ગુંદલાવ
जिटिहा-जं.3/2022-23
जोटीફાઇડ એરોચા વલાક, ચીફ ઓરીસર, વ્યાદસે નં. આવલોએલ-૮/૧૦૫, ૧૦૬
જીઆઇડીલો ગુંદલાય, ફોન (અંદર-22-2851) તરફથી જી. આઇ.ડી.સી. ગુપરાત રાજય
જોડ લોઇકામ વિભાગ ગુપરાત લોઇલીંગ લોઇ અને જોડ આઇ.ડી.સી. ગુપરાત રાજય
જોડ લોઇકામ વિભાગ ગુપરાત લોઇલીંગ લોઇ અને જોડ આઇ.ડી.સી. ગુપરાત રાજય
જોડ લોઇકામ વિભાગ ગુપરાત લોઇલીંગ લોઇ અને જોડ આઇ.ડી.સી. ગુપરાત રાજય
લોકોમાં નોધાકેલ ચારીલો કોક્યુકાટ્ટરો પાતેથી જુંદા પૂર્વ છામોનો કેન્ડની મોટના ભાય
મંત્રાયતામાં આવે છે. જે કામોની અંદરીકૃત કિમત રૂ. ૫.૦૦ લાખ થી રૂ. ૫૫.૦૦ લાખ
લોક પેતા અનુ ..ન. ઓનહાલાખ પદ્ધતિથી અને અનુ ..ન. એનોલલામ પદ્ધતિથી
મંત્રાયતામાં આવે છે. જે-કરફોમ શ્રમ્યુક રચાની લાઇમ. સ્દ/૧/૨૦૨૨ થી તા. ૨૫/૧/૧/૨૦૨૨
સ્થેરી સમગ્ર દરમાં લોક ઓફિસ્સ, નિર્દિપ્ટ વિસ્તાર વલાકાર્કો કહેમોમાંથી જારી
કરવામાં આવશે. ભેદન-પત્રને સ્વીક્સ્સનાની આપત્રી તા. ૩/૧/૧/૨૦૨૨ સાથ શોજ ૧૫.૦૦
લાધ સુધીમાં સંદીકિત્યમાં આવશે એને ઓલીઠ અંદરે તા. ૧૫/૧/૧/૨૦૨૨
સ્થેરી સમગ્ર દરમાં કામની કિલિદા ઓફિસના નોટીસ લોઇ ઉપર તેમજ વેબ સાઘદ
www.nprocure.com માં જોવા મળારો ઓનહાલાં ટેસ્ટર ડાઉનલોડ અને ઓનલાં કોજ સ્ટર ખોતવાની
લાઇમાં અને ૧/૧/૧/૨૦૨૨ સોચ સ્વીક્સના કોશ એનો અને અને ઓનલાં લોઇ તરે કર્યા પ્રાદ્યાની લોઇમ અને પ્રાપ્ત કામન દરમ્યાન સુધ પ્રયુધ કરોન અને ઓનલાં લોઇ સ્ટર પોતાનાની વેરફીયાત લોઇમ લાઇની. ૧/૧/૧/૨૦૨૨ સોચ સાધાદા વિનંતી છે. ઓનલાંની સ્વરફીયાત લોઇમાં લેપની એન અચાર સ્ટેન કર્યાનું સ્ટરી નોતા સ્તિકિક્ટ, લાલાની કરોમો, માંગ માં સ્વર્થનો સ્વર્થન સાધાદા વિનંતી છે. આનલાંની સ્ટર્મ, સ્વર્થનો અપ્લાર સ્વર્થન સ્વાર્થનો સ્વર્થનો, માં સ્વર્થન માં સાધાની/પત્ર સાધાદા વિનંતી પ્રાપ્ત અને સ્વર્થન સ્વર્થન સ્વર્થના સ્વર્થનો સ્વર્થનો માન સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્થનો સ્વર્યાન સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્શન સ્વર્યન સાધાદ્યાની સ્વર્થન માં માઇની/પત્રસાદ/પત્ર સ્વર્થન સ્વર્થન સ્વર્થન સ્વર્યન સ્વર્થન સ્વર્યન સ્વર્થન સ્વર્યન સાધાનો સ્વર્થન પત્ર સાધાની/પત્ર સાધાદ્યાન સ્વર્યન સાધાદ્યાન સાધાદ્યાન સ્વર્યન સાધાદ્યાની સાધાદ્યાની સ્વર્યન સ્વર્યન સાધાદ્યાની સ્વર્યન સાધાદ્યાની સ્વર્યન સ્વર્યન સાધાદ્યાની સાધાદ્યાની સાધાદ્યાની સ્વર્યની સાધાદ્યાની સાધાદ્યાની સાધાદ્યાની સાધાદ્યાની સાધાદ્યાની સાધાદ્યા

નં. માહિતી/ઘલસાડ/પ૧૮/૨૦૨૨

vagodara Municipal Corporation invites compequalification criteria mentioned in the tender docu

Project Detail

Bhayli T.P - 01 F.P - 114

Bhavli T.P - 03 F.P - 102

Bhavli T.P - 03 F.P - 125

Bhayli T.P - 03 F.P - 118

Vadoda

4

PRO No.740 / 2022-23

ઇ- ટેન્ડર્સીંગ જાહેરાત

ઇ– ટેઇક્ટિંગ જિન્સિંગ રોક્ટા મહાનગરપાલિકામાં યોગ્ય વિભાગ તેમુજ યોગ્ય શિલોમાં તોંધાયેલ માન્ય ઇખરદારો પાસેથી તથા સરકારી/અર્ધસરકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઇખરદારો પાસેથી નીચે જણાવેલ કામ માટે મહોસ્બંધ ભાવપત્રો મંત્રાવવામાં આવે છે. વિભાગનું નામ

વડોદરા મઠાનગરપાલિકા

रविवार ३० ऒड्टोजर, २०२२

9	७४२/२२-२ 3	પા.પુ.(ઇલે.મિકે.)	09	40,00,000/-
2	૭૪૫/૨૨-૨૩	યુ.સી.ડી.પ્રોજેકટ	06	9,43,२७,000/ -
3	986/22-23	બિલ્ડીંગ પ્રોજેકર	08	4,69,70,909/-
8	૭૫૧/૨૨-૨૩	ઢોર ડબ્બા શાખા	09	9,98,90,000/-
મસાઇ		ર્મ તથા વિસ્તૃત માહિતી જે તે ઇપણ ભાવપત્ર મંજુર/નામંજુ		

વેબસાઇટ પરથી મળી રહેયા. કમિશનસ્ત્રીની રહેશે. પી.આર.ઓ.નં.૭૫૩/૨૦૨૨-૨૩ જનસંપર્ક વિભાગ વ્હારા પ્રકાશિત પરિશિષ્ટ - ૧

लाहेर निविद्या

પંચાયત કચેરી, ધરમપુર ખાત રાખલ છ. પુર્વ લાયકાત અને ભાવપત્રના અલગ ભરેલા ટેન્ડર ફોર્મ ઉપર્યુક્ત અધિકારોને તા.03/૧૧/૨૦૨૨ ના રોજ ૧૬:૦૦ ક્લાક સુધીમાં મળી જાય તેમ મોક્લવાના

રહરા. શ્થળ :- તા.પં.કચેરી ધરમપુર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ધરમપુર તારીખ :- ૨७/૧૧/૨૦૨૨ નં. માહિતી/વલસાડ/૫૧૫/૨૦૨૨

रहेशे.

VADODARA MUNICIPAL CORPORATION
"PRADHAN MANTRI AWAS YOJNA"(PMAY)

er "Pradhan Ma

Pre-bid

Date & Time

07.11.2022

11:30 hrs 07.11.2022

11:30 h

11:30 hrs

07.11.2022

સંજય જી. લીંબાચીયા તે ખરીદનારના એડવોકેટ Dic ઓફિસ નં. : ૧૧૧, જોલી પ્લાઝા, અઠવાગેટ સર્કલ, સુરત-૧. મો.નં. ૯૮૨૪૩૮૪૬પા



જનતાએ નોંધ લેવી.

neeting the

Technical

bid opening

Date & Time

28.11.2022

17:01hrs 28.11.2022

17:01hrs

28.11.2022 17:01hrs

25.11.2022

16:00hrs 25.11.2022

16:00hrs

25.11.2022 16:00hrs

ગુજરાત માટીકામ કલાકારી અને ફરલ ટેકનોલોજી સંસ્થાન (ગુજરાત સરકારની સંસ્થા) ૫૪ પાસે, સેક્ટર-વર, ગાંધીનગર-૩૮૨૦૧૬ ફોના ૨૩૨૫૧૬૮-૧૮, કેક્સ, ૩૨૨૫૧૬૬૫ cMail:dir-gmkrti@gniarst nov i Amrit Mahotsa

ઃ સુરત મેઘવાળ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ**ઃ _{ઇ/કડવા/કુરત**}

કાશંવિલ ! ડો. આંગેડકર ઉદાન પાંતે, સેશદપુરા, માર્કીગાંડ, સુરત.
—: વાર્ષિક સામાન્ય સભા પૃત્રિય :-સુરત મેઘવાળ સમાજ એજવું કેળન ટૂસ્સની તાં. હ/૧૯/૧૦૨૨નો સોકુક શાંભ વાર્ષિક સામાન્ય (જનાદમ) અમા તા. ૧૩/૧/૧૦૨૨ને કેવિદાના રોજ સાલે, ૧૦.૦૦ કલાકે, SMC ગલેમાંડી કોમ્યુનીટી હોલ, સુચાર ફળિયા, લક્કક કોટ, ગલેમાંડી, સુરત ખાતે મોકુક રાખેલ સભાની કાર્યદ્ભાવિના કાંચી અંગે મળશે. એથી તમામ આદ્યાવન સભાસદોને સમસ્સ લજ્ય રહેવા વિતર્ભી છે.

હેંસાબેન અણજારા (પ્રમળ) વેચાણ અંગેની જાહેર નોટીસ

ડિસ્ટ્રીક્ટ સુરત, સબ-ડિસ્ટ્રીક્ટ બારડોલીના મોજે ગામ વરાડના ખાતા નંબર ૯૮૯, બ્લો:

નં.૨૯૨. ક્ષેત્રફળ હે.આરે.૨–૦૨-૩૪ ચો.મી. આકાર રા.૨૫.૨૫ પૈસા વાળી જની શરતની ખેતીની જમીન પ્રબોધકુમાર અંબેલાલ પરમારના નામે સ્વતંત્ર માલિકી, હકકે, હોવાનું જજ્ઞાવી સદરહુ જમીન અમારા અસીલને વેચાલ આપવાનું નક્કી કરેલ છે જેથી સદરહુ જમીનમાં હરકોઇનું જો કાંઇ હક્કહીત લાગભાગ હીતસંબંધ ગીરો, સહીલદારી હક્ક, વિગેરે અગર કાંઇ લેવા-દેવા કે નિસ્બત હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયાની

તારીખથી દિન-૭ ની મુદતમાં પુરાવા સહીતની લેખીત રજુઆત અમોને નીચેના ઠેડાણે

કરવી. મુદત વિત્યે અમારા અસીલ સદરહુ જમીન બાબતેનાં તમામ હકકો વેવ યાને જતા કરેલા હોવાનુ માની વેચાણ રાખવા સંદર્ભેની આગળની કાર્યવાહી પુરી કરશે તેની આથી

મોજે-વેસુ ના જુ.સ.નં.સ્ટ૪/૩૫, રીસર્વે નં.૧૭૮/૩૫ વાળી બીનખેતીની જમીનની વેચાણ અંગેની જાહેર નોટીસ

રનોંધલેવી. તા.૩૦/૧૦/૨૦૨૨ મારી મારફત **દાર્મેશ જે. લાડ** તે ખરીદનારનાં એડવોકેટ

તથા લાગતા વળગતા સર્વે કાઇએ ગંભીર નોંધ લેવી.

નોફ્રીસ :૧૧૩, ગુજરાત શોપીંગ, અમરોલી, સુરત

ફ્રો.નં.૦૨૬૧-૨૪૯૯૬૦૦, મો.નં.૯૮૭૯૩૪૪૮૮૬

કુંભારીકામ કારીગરો માટીની ઉર્જા કાર્યક્ષમ ું ભઠ્ઠી યોજના અને સાધન સહાય યોજના અંતર્ગત ઇ-કુટીર પોર્ટલ મારફત લાભાર્થીઓની ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત માટીકામ કારીગરોની ઉત્પાદન પ્રક્રિયા સરળ બનાવવા અને આરોગ્ય સામેનું જોખમ ઘટાડવા સંસ્થા કારા માટીકામ કારીગરો માટેની (૧), સાધન સહાય

જોખમ ઘટાડવા સંસ્થા કારા માટીકામ કારીગરો માટેની (જ). સાધન સહાય પોજના અન્ય છે હપ્ય સરકારશીની સબસીડીથી વાઉનગત માટીકામ કારીગરોને ઇલેક્ટ્રીક પગમીલ અને ઇલેક્ટ્રીક ચાક તથા (૨). ઉર્જા કાર્યક્રમ બદ્દી યોજના અન્ય છે કાર્યક્રમ બદ્દી યોજના અન્ય કે હર્મામ બદ્દી આપવામાં આવે છે. હજે કાર્યક્રમ બદ્દી આપવામાં આવે છે. હજે કાર્યક્રમ કામગીરી સાથે સંકાળયેલા કારીગરો પાસેથી ઇન્દુરિક પોર્ટલ https://e-kurit.gujurat.gov.in કારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. યોજનાઓ અંગી વધુ વિગતો જેવી કે પાત્રતાના ધોરણો, સહાયના ધોરણો, અરજ સાથે રજુ કરવાના દસ્તાવેજોની ચિતાનો ઇન્દુરિક પોર્ટલ ઉપર જોઇ કારાકો, અરજ સાથે રજુ કરવાના દસ્તાવેજોની ચિતાનો ઇન્દુરિક પોર્ટલ ઉપર જોઇ કારાકો, આપતા ધોરણો, સહાયના ધોરણો, અલ્લાના ધોરણો, સહાયના ધોરણો, અલ્લાના ધોરણો, અલ્લાના ધોરણો, અલ્લાના ધોરણો, સહાયના ધોરણો, અલ્લાના ધોરણો, અલ્લાના ધોરણો, અલ્લાના ધોરણો, અલ્લાના ધોરણો, સહાયના ધોરણો, અલ્લાના ધોરણો, સહાયના ધોરણો, સહાયના ધોરણો, સ્તાના ધોરણો, સહાયના ધારણો, પાત્રતા ધરાવતા લાભાર્થીની પસંદગી વર્ષ-૨૦૨૨-૨૩ના લક્ષ્યાંકો મજબ વહેલ પાતા પરાવતા સાળાવાના પરાટ્યા પ્યત્યાર કરાયાં સવાડા મુજબ યહેલાં તે પહેલાના ધીરણે અગ્રતાક મુજબ કરવામાં આવશે. આ યોજનાઓની અરજી ઓનલાઇન કરવા માટે સહાયતા માટે મો. નં. ૯૪૨૬૫૭૮૪૨૪ અને ૭૪૩૪૮૫૨૬૩૩ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. માહિતી/ ૧૮૬૧/ ૨૨-૨૩

વ્યારા વિભાગીય કચેરી દદ કે.વી. વ્યારા કંપાઉંડ, ધુલિયા હાયવે, વ્યારા-૩૯૪૬૫૦. ડીજીવીસીએલ ટોલ ફ્રી નં. ૧૯૧૨૩ (કે ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩)

વીજ પુરવઠો બંધ રહેવા અંગેની જાહેર સુચના.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ

CIN U40102GJ2003SGCO42909

ચીફ ઓફીસર(નિ.વિ.).

EMD (2%

15,81,000

13.59.660

20,23,680

37.31.160

Estimated

Project Cost

Rs. in Lakhs

790.50

679.83

1011.84

1865.58

RE-INVITATION OF BIDS ON AFFORDABLE HOUSING FOR ECONOMICALLY WEAKER SECTION

78 Municipal Corporation invites competition Bids from the appropriate Competition Bids from the Appropriat

limit

Months

24

24

24

24

GENERAL INSTRUCTIONS: (1)The Tender documents for these works can be downloaded from website www.nproeure.com: (2) Non refundable Tender fees of Rs.20000/-for project cost upto 25.00 or & Rs.30000/- for project cost above 25.00 or in the form of DD for each package separately, drawn in favour of "Municipal Commissioner" Vadodara Payable at Vadodara. (3) Joint Venture is Not allowed. (4) Conditional Tender shall not be accepted. (5) Soft copy to be submitted by \$5/11/022(2,6) for Project Cost tender than 5.00crore. EMD of the project shall be submitted in form of DD or Bank Guarantee and Project Cost less than 5.00crore EMD in form of DD shall be submitted (7) Hard copy of Technical Bid, original copy of Iechnical Bid. Acquired refees, EMD drawn in favour of "Municipal Commissioner" Vadodara and copy of Solvency Certificate shall be submitted to the office of the Executive Engineer, Affordable Housing (PMAY) Vadodara Municipal Corporation, Kanya shala no-03, Pratap road, Raopura Vadodara-390001 by Registered post/Speed post only on or before Date: 28/11/2022 up to 16:00 hrs. Municipal commissioner reserves the right to accept or reject any or all tenders without assigning any reason thereof. This Tender notice shall form a part of contract document.

Visit us at: www.vmc.gov.in, www.vmcegov.com Phone: 0265-2433116, 2433118, 2433369, 2433388 Fax: 2433060

up Housing Facility

online Tender

Document Date & Time

29.10.2022

16:00 hrs 29.10.2022

16:00 hrs 29.10.2022

16:00 hrs

29.10.2022

આથી અમારા માનવતાં ગ્રાહકોને જણાવવાનું કે, દ.ગુ.વીજ.કે.લિ. ફારા ૧૧ કેવી લાઇન નું જૂકરી સમારકામ કરવાનું હોવાથી નીચે જણાવેલ તારીખ તથા સમયે તે સબસ્ટેશન માંથી ફીડર પરથી વીજ પુરવઠો મળી શકશે નહીં. ક્રમ સબ-સ્ટેશન કીડર સબ-ડીવીઝન ફોલ્ટ સેન્ટર નં.

9	૬૬કેવી ગાળાકુવા	૧૧ કેવી ધમોડી જેજીવાય ફીડર ૧૧ કેવી ગતાડી એજી ફીડર	કપુરા	६३५७०७७७११	૦૧.૧૦.૨૦૨૨/ મંગળવાર	૦૮.૦૦ ચી૧૮.૦૦
2	૬૬કેવી કપડવણ	૧૧ કેવી ઢોલીઉમર જેજીવાય ફીડર ૧૧ કેવી મેધપુર એજી ફીડર	કપુરા	६३५७०७७७११	૦૨.૧૦.૨૦૨૨/ બુધવાર	૦૮.૦૦ થી૧૮.૦૦
3	૬ ૬કેવી મગરકુઇ	૧૧ કેવી જેતવાડી એજી ફીડર ૧૧ કેવી મદાવ જેજીવાય ફીડર	કપુરા	६३५७०७७७११	03.90.૨0૨૨/ ગુરૂવાર	૦૮.૦૦ થી૧૮.૦૦
8	૬૬કેવી જેસીંગપુરા	૧૧ કેવી કાંજણ એજી ફીડર ૧૧ કેવી રામકુવા જેજીવાય ફીડર	કપુરા	६३५७०७७७११	૦૪.૧૦.૨૦૨૨/ શુક્રવાર	૦૮.૦૦ થી૧૮.૦૦

કાર્યપાલક ઈજનેર (સં.નિ) વ્યારા વિભાગીય કચેરી, દ.ગુ.વિ.કં.લિ એમ.સી.બી./ઇ.એલ.સી.બી.

વેચાણ અંગેની જાહેર નોટીસ

આ જાતંર નોટીસ કારા જણાવવાનું કે, નવસારી જીલ્લાના નવસારી તાલુકાના મોજે પીનસાડની નીચે શીદ્યુલમાં જણાવેલ ખેતીની જમીનો, જમીનોની વિગતની બાજુમાં દ્યાંવેલ માલિકોએ તેઓની સ્વતંત્ર માલિકી કબ્જા ભોગવટની ચાલી આવેલી હોવાનું જણાવી હામારા અસીલને વેચાણથી આપવાનું કર્મી કરવે કહ્યું એ જને બચાર અર્ધી સાર્વે અને વાર્ચ કર્યા મિલકતનું શીક્યુલ

€.94

11.94

6.84

8,093.59 8,783.03

1.219.95 1.336.73

1,219.95 1.336.7

915.0

917.5

1,200.34

ક્ષેત્રફળ .આરે.ચો.મી.

0-97-79

9-25-45

9-06-66

સમય	
૦ થી૧૮.૦૦	
ગ્યી૧૮.૦૦	-
ગ્યી૧૮.૦૦	9
ગ્યી૧૮.૦૦	
વા વિનંતી છે.	

Azadi _{Ka} Amrit Mahotsav

889

886 969

તાલુકા

960 295

290

299

જુનો બ્લોક

નંબર નંબર

960

મગનભાઈ છેટુંબાઈ પટેલ રહે. પાટીદાર મહેલલી, ગામઃ પીનસાડ, તાલુકા-નવસારી, જીલ્લા-નવસારી હાલ રહેવારી: 28. CALEDONIA STREET, MIRAMAR-6022, WELLINGTON, NEW ZEALAND. તા. ૨૯-૧૦-૨૦૨૨ ઓ.: ૨૯૬૪, પ્રથમ માળે, આર એન્ડ એસ શોર્પીંગ સેન્ટર, પોષ્ટ ઓફિસની બાજુમાં, મુ.પો. તેસ્મ-૩૯૬૪૬૫ તાલુકા: જ્લાલપોર, અલ્લા: નવસારી, ગુજરાત. મો.: 098985 64135, ઇ-મેઇલ: adv_sorathod@vahoo.com

રજિસ્ટર્ડ ઑકિસ: સર્વે નં.324/4 થી 7 ઑફ કાચિગામ, ગામ કાચિગામ, દમણ 396 210. ફ્રોના (022) 2886 3426/ 3427 **| ઇ−ોઇલ:** wimplast@celloworld.com **સીઆઇએન:** L25209DD1988PLC001544 **| વેબસાઇટ:** www.cellowimplast.com

16,044.52 13,779.82

2.530.53

2.530.53

1,900.8

1,701.74

1,701.74

10.79 10.79

પર્શા થયેલ વ

31.03.2022

31,875.1

4.676.6

4 676 6

39,982.36

29.13 29.13

શાંતુબાઈ છોટુબાઈ પટેલ મઃ પીનસાડ. તાલકા-નવમ

રે. પટેલ ફળીયુ, ગામ: પીનસાડ, તાલુકા-નવસારી, જીલ્લા-નવ હાલ રહેવાસી: 99, SLOUGH LANE, KINGSBURY, LONDON, NK19 84B, U.K

૧૧ દૃદ્દ કે.વી. કોસાડ

૧૨ દૃદ્દ કે.વી. કોસાડ

ડીજીવીસીએલ ટોલ ફ્રી નં. ૧૯૧૨૩ (કે ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩) વીજ પુરવઠો બંધ રહેવા અંગેની જાહેરાત રા માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે અગત્થની સમારકામગીરીનાં કારણે નીચે જણાવેલ ફીકર પરથી નીચે જણાવેલ અને સમયે વિજપુરવઠો મળી શકરો નહિ. કામગીરી પૂર્ણથયે કોઇપણજાતની જાણ કર્યા વગર વિજપુરવઠો ચાલુ કરી

	દેવામાં આવશે. જેની નોંધ લઈ સહકાર આપવા વિનંતી.							
84	સબ-સ્ટેશન	ફીડર	संविधियन	ફોલ્ટરોન્ટર નં.	તારીખ/વાર	સમય		
٩	દ્દ કે.વી. કોસમાડા	૧૧ કે.વી. રાજહંસ	સરથાણા	८७८०८०३८४६	૦૧.૧૧.૨૨/ મંગળવાર	୦૯.୦୦ ଥ <u>ି</u> ୧८.୦୦		
5	દૃદ્દ કે.વી. કોસમાડા	૧૧ કે.વી. રુદ્રા	सरथाला	८७८०८०३८४६	09.99.22/	୦୧.୦୦ ଥୀ		

સુરત ગ્રામ્ય વિભાગીય કરોરી ઊर्ज सहननी सामे, नाना पराछा रोड, आपोद्रा यार रस्ता,

ક્રમ	સબ-સ્ટેશન	ફીડર	संंधियं	ફોલ્ટરોન્ટર નં.	તારીખ/વાર	સમય
٩	દૃદ્દ કે.વી. કોસમાડા	૧૧ કે.વી. રાજહંસ	સરથાણા	<6<0<03<8<<	૦૧.૧૧.૨૨/ મંગળવાર	96.00
5	દૃદ્દ કે.વી. કોસમાડા	૧૧ કે.વી. રુદ્રા	સરથાણા	<6<0<03<8<	૦૧.૧૧.૨૨/ મંગળવાર	96.00
3	દૃદ્દ કે.વી. સરથાણા	૨૨ કે.વી. ગીરનાર	સરથાણા	<6<0<03<8<	૦૨.૧૧.૨૨/ બુધવાર	96.00
8	इइ डे .वी. वरीयाव	૧૧ કે.વી. બળિયાદેવ	કોસાડ	८७८०८०३८५१	૦૨.૧૧.૨૨/ બુધવાર	96.00
ч	દૃદ્દ કે.વી. સરથાણા	૨૨ કેવી લક્ષ્મણનગર	સરથાણા	८६८०८०३८४६	૦૩.૧૧.૨૨/ ગુરુવાર	96.00
ξ	દ્દ કે.વી. કોસાડ	૧૧ કે.વી. વેલકમ	કોસાડ	८७८०८०३८५१	૦૫.૧૧.૨૨/ શનિવાર	96.00
6	દૃદ્દ કે.વી. કોસાડ	૧૧ કે.વી. શ્રુતિ	કોસાડ	८७८०८०३८५१	૦૫.૧૧.૨૨/ શનિવાર	96.00
۷	દ્દ કે.વી. કોસાડ	૧૧ કે.વી. રજવાડી	કોસાડ	८६८०८०३८५१	૦૫.૧૧.૨૨/ શનિવાર	96.00
e	દ્દ કે.વી. કોસાડ	૧૧ કે.વી. વર્ણી	કોસાડ	८६८०८०३८५१	૦૫.૧૧.૨૨/ શનિવાર	96.00
90	દ્દદ્દ કે.વી. કોસાડ	૧૧ કે.વી. આસ્થા	કોસાડ	CECOCO3C49	૦૫.૧૧.૨૨/	06.00 8

કોસાડ

કોસાડ

CECOCO3C49

CGCOCO3C49

૧૧ કે.વી. પ્રમુખ

1. <u>ء</u> ھا -ലി थी थी

થી , ലി થી oc.oo al 04.99.22/ १८.०० ०६.०० थी 04.99.22/ शनिवार 96.00 ୦୧.୦୦ ଥା 96.00 કાર્યપાલક ઈજનરે (સં.અને નિ.), સુરત ગ્રામ્ય વિભાગીય કચેરી, દ.ગુ.વી.કં.લિ એમ.સી.બી./ ઈ.એલ.સી.બી./ આર.સી.સી.બી. લગાવી વીજળીના ઝટકાથી બચો અને વીજ અક્સમાતો ટાળે 30 સપ્ટેંબર, 2022 ના રોજ પૂરાં થયેલા ત્રેમાસિક અને અર્ધવાર્ષિક મુદત માટેના બિનતપાસેલ નાણાકીય પરિણામોનો સારાંશ Particulars

શૅર દીઠ આવક (પ્રત્યેક રૂ.10/- નો) ચાલુ અને બંધ કરેલા કાર્યો માટે)

cello Wim Plast Ltd.

પર્હા થયેલ ત્રેમાસિક પૂર્ણ થયેલ અર્ધવાર્ષિક પૂર્ણ થયેલ વર્ષ પર્દા થયેલ ત્રેમાસિક પૂર્ણ થયેલ અર્ધવાર્ષિક 30.09.2022ml 30.06.2022ml 30.09.2021ml 30.09.2022ml 30.09.2022ml 31.03.2022ml 30.09.2022ml 30.09 0.09.2022ના 30.09.2021 બિનતપાસેલ બિનતપાસે

	બિનતપાસેલ	બિનતપાસેલ	બિનતપાસેલ	બિનતપાસેલ	બિનતપાસેલ	તપાસેલ	બિનતપાસેલ
સંચાલન માંથી થયેલી કુલ આવકો (ચોખ્ખી)	7,886.43	8,038.93	8,671.60	15,925.36	13,974.48	31,675.41	7,950.94
મુદત માટે થયેલો ચોપ્ખો નફો /(ખોટ) (કર, અપવાદરૂપ અને/અથવા અસામાન્ય આઇટમો પહેલા)	1,276.02	1,210.38	1,354.75	2,486.39	1,758.24	4,759.32	1,310.58
મુદત માટે કર પહેલા થયેલો ચોખ્ખો નફો/(ખોટ) (અપવાદરૂપ અને/અથવા અસામાન્ય આઇટમો પછી)	1,276.02	1,210.38	1,354.75	2,486.39	1,758.24	4,759.32	1,310.58
મુદત માટે કર પછીનો ચોખ્ખો નફો/(ખોટ) (અપવાદરૂપ અને/અથવા અસામાન્ય આઈટમો પછી)	959.99	907.96	1,019.81	1,867.94	1,321.19	3,533.92	985.80
મુદત માટેની કુલ સર્વગ્રાહી આવક (જેમાં મુદત માટેનો નકો/(ખોટ) (કર પછીની) અને અન્ય સર્વગ્રાહી આવક (કર પછીની) સામેલ છે)	1,029.22	913.25	1,036.53	1,942.47	1,345.40	3,562.68	1,044.72
ઈક્વિટી શૅર કૅપિટલ	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34	1,200.34
અન્ય ઇક્વિટી						40,074.92	

ર્નીધ:
1. ઉક્ત માફિતી રોબી (લિસ્ટિંગ ઑબ્લિગેશન્સ એન્ડ ફિસ્કલોઝર રિકલાયરમેન્ટ્સ) નિયમન 2015ના 33 ફેઠળ શેરબજારમાં નોંધાવવામાં આવેલા સપ્ટેમ્બર 30, 2022ના રોજ પૂર્ણ એક પૂર્વ એક પોર્ટા એક પો

તારીખઃ ઓક્ટોબર 27, 2022

1. બેઝિક

2. ડાયલ્યુટેડ

પ્રદીપ જી. રાઠોડ

ઑફ ડાયરેક્ટર્સ માટે અને વર્તી **વિમ પ્લાસ્ટ લિમિટેક**

15.73

(સીઇઓ, ચેરમેન અને મેનેજિંગ કાયરેક્ટર) (DIN - 00027527)